

અત્યારે જોડાવ!!!  
અથવા  
ટોલ ફી  
1800-110-069



પેન્શન ફંડ નિયમન અને વિકાસ સત્તા મંડળ

## અટલ પેન્શન યોજના સાથે જોડાવ!!!



એપીવાય હેઠળ વૃદ્ધાવસ્થા દરમયાન મળનારા ફાયદાઓ હાલની નાની રોકાણ યોજનાઓ કરતા ઘણા આગળ છે!!!

એપીવાય શું છે?	કોના માટે?	એપીવાય શા માટે?	જેવી રીતે જોડાઈ શકાય?
<ul style="list-style-type: none"> <li>ભારત સરકારની ગેરંટેડ પેન્શન યોજના</li> <li>લાભાર્થી નિયમિત રીતે ચોક્કસ રકમ જમા કરાવે</li> <li>માસિક રૂ. 1000 થી રૂ. 5000નાં માસિક ન્યનૂતમ પેન્શનની બાહેધરી</li> <li>કુટુંબને વધારે પેન્શન મળે તે માટે પતિ પત્ની અલગ અલગ એપીવાય ખાતું ખોલાવી શકે છે</li> </ul>	<ul style="list-style-type: none"> <li>18 થી 40 વર્ષના બધાજ ભારતીય નાગરીકો માટે</li> <li>ઉપરના વયજુથના હાલના સ્વાવલંબન લાભાર્થીઓ માટે</li> <li>જો તમારે કર છૂટનો લાભ ઉઠાવવો હોય તો</li> </ul>	<ul style="list-style-type: none"> <li>ત્રણ નિશ્ચિયત લાભો</li> <li>લાભાર્થીને ન્યનૂતમ પેન્શનની બાહેધરી</li> <li>લાભાર્થીનાં મૃત્યુના કિસ્સામાં જીવનસાથીને ન્યનૂતમ પેન્શનની બાહેધરી</li> <li>નોભીની રૂ. 1.70 લાખ થી રૂ. 8.50 લાખની પેન્શન સંપત્તિ મેળવે</li> </ul>	<ul style="list-style-type: none"> <li>તમારી બેન્કનો સંપર્ક કરો</li> <li>સરળ એપીવાય રજિસ્ટ્રેશન ફોર્મ ભરો</li> <li>માસિક/ત્રિમાસિક/અર્ધવાર્ષિક યોગદાન આપો</li> <li>આધાર આવશ્યક નથી</li> </ul>

એપીવાય સહૃના માટે નિવૃત્તિની ઉત્તમ પસંદગી છે!!!